



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૩/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૦૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૧ કેસ કરી, ૧૮ વ્યક્તિઓને ઝડપી, ૫૫ લીટર દેશી દારૂ, ૫૩૧ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧૦ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૩૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૦૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૪૦૫/૧૯

નરોડા: કિરીટભાઈ શંકરભાઈ પટેલ (ઉ.વ.૫૨)(રહે.શિવદર્શન સોસાયટી નવયુગ વિદ્યાલય પાસે નરોડા) એ તા.૦૨/૦૩/૧૯ ના રોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૨/૧૯ ના બે ત્રણ દિવસ બાદ બપોરે ૨/૦૦ વાગ્યાના સુમારે તેમજ તા.૨૨/૦૨/૧૯ સાંજના ૫/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે મો.નં.-૯૧૧૨૪૭૧૦૬૮૧૩ ના ધારકે એસ.બી.આઇ. મુંબઈથી ક્રેડિટ કાર્ડ માટે ફોન કરેલ વ્યક્તિએ કિરીટભાઈને વિશ્વાસમાં લઈ, “તમારા ક્રેડિટ કાર્ડ ઉપર ડીસ્કાઉન્ટ આપવાનું હોય જેથી તમારા મોબાઇલ ફોનમાં એક મેસેજ આવશે જે મેસેજમાં ચાર આંકડાનો નંબર મને આપો” તેમ જણાવતાં કિરીટભાઈએ પોતાના મોબાઇલ ફોનમાં આવેલ ચાર આંકડાનો નંબર અજાણી વ્યક્તિને આપતા, તા.૨૩/૨/૧૯ ના રોજ એસ.બી.આઇ બેંક મારફતે જાણ થયેલ કે કોઈ અજાણી વ્યક્તિએ કિરીટભાઈના ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન ખરીદી કરી કુલ રૂપિયા ૮૦,૦૦૦/- ખરીદી કરી, કિરીટભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એચ.બી.વાઘેલા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૪૦૬/૧૯

વટવા: સત્યપ્રકાશ ભગવાનસિંહ શર્મા (રહે. સાકાર ટેનામેન્ટ કેડીલા બ્રિજ પાસે ઘોડાસર વટવા) એ તા.૦૨/૦૩/૧૯ ના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૨/૧૯ સાંજના ૫/૩૦ થી તા.૦૯/૦૨/૧૯ સવારના ૩/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરની લોખંડની જાળીનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી,તિજોરીમાંથી ચાંદીની પાયલ-૨ જોડી કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ચાંદીના સિક્કા કિંમત રૂપિયા ૧૭,૦૦૦/-,ચાંદીના બિસ્કીટ કિંમત રૂપિયા ૮,૦૦૦/-, સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૩૦૦૦/-, એલ.સી.ડી.ટીવી કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.દેસાઈ ચલાવે છે.

સોનાની ચેઇન ખેચી તોડી લઇ ગયા:-

સમાચાર યાદી નં.૪૦૭/૧૯

પાલડી: વર્ષાબહેન વા/ઓ ભરતભાઈ શાહ (ઉ.વ.૬૧)(રહે.અશ્વરથ એપાર્ટમેન્ટ ગેલેક્સી સિનેમા પાસે, નરોડા) તા.૦૨/૦૩/૧૯ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે સુખીપુરા બસ સ્ટેન્ડ પાસે, ધર્મિષ્ઠનગર સોસાયટી સામેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાઇકલ ઉપર આવેલ બે પુરૂષ વર્ષાબહેનના ગળામાંથી સોનાની ચેઇન પેડલ સાથે કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ વર્ષાબહેન શાહે પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.જે.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૪૦૮/૧૯

“જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: મનોજભાઈ વેલજીભાઈ કટારા (ઉ.વ.૧૫) (રહે. નારોલ બ્રીજ નીચે ઈસનપુર) તા.૦૨/૦૩/૧૯ રાતના ૯/૧૫ વાગ્યાના સુમારે નારોલ બ્રીજ નીચે ચામુંડાનગર સોસાયટી સામેથી ચાલતા પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સફેદ રંગની માફતિ કારના ચાલકે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મનોજભાઈને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની ફરીયાદ કલસિંગ લાલાભાઈ પારઘીએ “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.બી.નાગોરી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૪૦૯/૧૯

ઘાટલોડીયા: ભાવેશભાઈ સુરેન્દ્રભાઈ દેસાઈ (ઉ.વ.૪૧) (રહે.કિર્તી એપાર્ટમેન્ટ શંકરદા હોલની બાજુમાં કેકેનગર ઘાટલોડીયા) એ બિમારીથી કંટાળી તા.૦૨/૦૩/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

રાણીપ: ગીતાબહેન ઓમપ્રકાશ ઓમનાથ (ઉ.વ.૫૦) (રહે. હરીઓમ કોમ્પલેક્ષ સુંદરવન રાણીપ) એ ડીપ્રેશનમાં આવી તા.૦૧/૦૩/૧૯ નારોજ પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાપી દીધી હતી. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૨/૦૩/૧૯ કલાક ૬/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એ.વસાવા ચલાવે છે.

ચાંદખેડા: અંજનાબહેન વા/ઓ ગોપાલ યાદવ (ઉ.વ.૩૫) (રહે. ગાયત્રીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાંદખેડા) એ અગમ્ય કારણસર તા.૦૧/૦૩/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની એંગલ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.સોલંકી ચલાવે છે.

ખોખરા: રાજકુમારીબહેન વા/ઓ બલ્લુભાઈ રિતોરિયા (ઉ.વ.૩૭) (રહે.બળદેવભાઈની ચાલી ભાવનાનગર ભાઈપુરા ખોખરા) એ અગમ્ય કારણસર તા.૦૧/૦૩/૧૯ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી મકવાણા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.